



WIRES & CABLES

AN ISO 9001:2015 CERTIFIED COMPANY

JIGAR CABLES LIMITED

Registered & Corporate Office

Plot No. 164/14 & 15, Jamwadi GIDC - 2
Gondal - 360 311 Dist. Rajkot (Gujarat) INDIA
Tel : +91 2825 221422
Web : www.sigmacab.com
E-mail : info@sigmacab.com
CIN No. : L28999GJ2017PLC095651

September 04, 2021

To
BSE Limited (SME Platform)
P. J. Towers,
Dalal Street,
Mumbai – 400 001.

Dear Sir,

Sub: Publication of Advertisement of Notice of 5th Annual General Meeting, Book closure and E-voting in Newspaper by Company

Ref: Scrip Code: 540651 Security ID: JIGAR

Respected Sir/Madam,

Pursuant to Regulation 41 of SEBI (Listing of Obligations and Disclosure Requirements) Regulation, 2015, we enclosed herewith News Paper advertisement of the 5th Annual General Meeting to be held on September 28, 2021, book Closure and information of E-voting was duly published in following newspaper:

THE FINANCIAL EXPRESS [English Newspaper] dated September 04, 2021
THE FINANCIAL EXPRESS [Gujarati Newspaper] dated September 04, 2021


The copy of advertisement published is enclosed for your reference.

Kindly consider the same and take on record.

Thanking You.


For, JIGAR CABLES LIMITED

Priyanka Marwania



CS Priyanka K. Marvania
Compliance Officer & Company Secretary
Membership No.: A58477

Encl: a/a



PUBLIC NOTICE

That Jayrambhai Ramabhai Desai is an absolute Owner of Plot No. 1/B & 1/C Paiki First Floor measuring 1152 sq. feet i.e. 107.06.32 sq. mts., in "Krushna Nagar Co. Op. Ho. Society Ltd. Part-2", Situated at Revenue Survey No. 470 & 471/2, T. P. Scheme No. 12, Final Plot No. 14, of Moje Adajan, City of Surat. That The Present Owners have informed us that, the Following Document as Described in Schedule has been SUBMITTED by him And That Never Ever It was used as Security for Obtaining Any Financial Assistant by him or Anyone Else.

Any person or persons, Society, institution, Court Case, Group, Trust, Banks etc. owing any right of ownership or possession or lien or claim of whatsoever nature in respect thereof are hereby informed to raise any such rights or claims, all within a period of 05 (Five) Days from the date of publication of this notice personally before the undersigning along with all documentary proof in original, upon Expiry of which, no rights or claims of whatsoever nature shall be Entertained.

SCHEDULE OF SUBMITTED ORIGINAL DOCUMENTS

Sale Deed Regi No. 8613 & Its Regi Receipt, Dated 14/06/2011
Sale Deed Regi No. 6848 & Its Regi Receipt, Dated 11/09/2003

Date : 04/09/2021, Surat
5/1208, Haripura Main Road,
Surat, Ph. (0261) 2412226,
Mob. 98254 20370

Dineshchandra N. Upadhyay,
Pranav D. Upadhyay
Dhaval D. Upadhyay
Advocates



OSIA HYPERMART LIMITED
CIN: L52190GJ2013PLC077269

Registered office- Basement Store 1, 4d Square, Opp. IIT Eng College, Nr. D-Mart
Visat Gandhinagar Highway, Motera, Ahmedabad 380005 Tel. (079) 22747148
Email : cs2013.ohrl@gmail.com, Website: www.osiahypermart.com

NOTICE OF THE 08TH AGM, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 08th Annual General Meeting ("AGM") of the Company will be held on Thursday, the 08th September, 2021 at 1.00 p.m. IST through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice dated 31st August, 2021 convening the AGM. The Company has sent the Annual Report 2020-21 along with the Notice convening AGM through electronic mode only to the members whose email addresses are registered with the Company and/or Depositories in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with its circulars dated 8th April, 2020, 13th April, 2020, 15th June, 2020, and 15th January, 2021 and SEBI circular dated 12th May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.osiahypermart.com and on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com and also on website of National Stock Exchange of India Limited at www.nseindia.com.

NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24th September, 2021 to 30th September, 2021 (both days inclusive), for the purpose of 08th AGM of the Company.

As per the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting' as under and also 'e-voting' at the time of AGM on all the resolutions set forth in the said Notice. The details are required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made there under are given here under:

1. Date of completion of dispatch of Notice of AGM through email only	03rd September, 2021
2. Date & Time of commencement of Remote e-voting	9.00 a.m. on 27th September, 2021
3. Date & Time of end of Remote e-voting	5:00 p.m. on 29th September, 2021
4. Cut-off date for determining rights of entitlement of Remote e-voting	23rd September, 2021
5. Those persons who have acquired shares and have become members of the Company after emailing of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company/ in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM.	
6. Remote e-voting shall not be allowed beyond	After 5.00 p.m on 29th September, 2021
7. Manner of casting e-votes on resolutions during AGM (VC/OAVM)	E-voting facility will be available during AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM may remain present at AGM through VC/OAVM but shall not be entitled to cast their e-vote again during AGM
8. Electronic Voting system & VC/OAVM platform provider	National Securities Depository Limited ("NSDL") www.evoting.nsdl.com
9. In case of any queries in connection with the facility for remote e-Voting and any other queries, the members may refer to the Frequently Asked Questions ("FAQs") for members available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990/ 1800-224-430 or send a request to NSDL, Trade World, A Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Panel, Mumbai - 400 013 at evoting@nsdl.co.in or at telephone number.	

By order of the Board of Directors
For, Osia Hyper Retail Limited
SD/-
Yusuf Rupawala
Company Secretary & Compliance Officer
Place: Ahmedabad
Date: 04.09.2021

JIGAR CABLES LIMITED

SIGMA SUPER
WIRES & CABLES GUJARAT (INDIA), CIN : L28999GJ2017PLC09565
Website : www.sigmacab.com, Phone : +91-2825-221422,
Email : info@sigmacab.com

Notice for 5th Annual General Meeting, Book closure and E-Voting

NOTICE is hereby given that the 5th Annual General Meeting (AGM) of Jigar Cables Limited will be held on Tuesday, September 28, 2021 at 04:30 P.M. at the Registered Office of the Company situated at Plot No. 164/14 & 15, Jamwadi G.I.D.C., Gondal, Dist. : Rajkot - 360311, (Gujarat), India to transact the business as set out in the notice approved in Board Meeting dated August 27, 2021 convening AGM.

The Notice of AGM along with Annual Report has been sent by email to all those members of the Company whose email ids are registered with the Depository Participants. For those members who have not registered their email addresses, physical copy of notice is being sent through the permitted mode. Shareholders who have not registered their email addresses so far, are requested to register their email address in prescribed form attached with Notice.

The Annual Report of the Company for the F.Y. 2020-21 along with notice will also be available on the website of Company www.sigmacab.com, website of Bombay Stock Exchange at www.bseindia.com & National Securities Depositories Limited (NSDL) at www.evoting.nsdl.com
Log in credential has already been sent to those members whose email id is registered with the DP/Company by an email. Members who have not registered/updated their email ids are requested to register the same by an email to cs@sigmacab.com by providing DP/Client ID, Name, PAN, Mobile and Email ID. Members who have not registered their email addresses will be able to cast their vote through remote e-voting or through the voting system during the meeting as provided in the notice. The instructions for attending and voting shall be provided in the Notice of 5th AGM which can be accessed at the above mentioned websites.

Notice is hereby also given, pursuant to Section 91 of the Companies Act, 2013 (the Act) read with Rule 12 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the SEBI Regulation), that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from September 22, 2021 to September 28, 2021 (both days inclusive) for the purpose of ensuring AGM.

In terms of Section 108 of the Act read with Rule 20 of the Companies (management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the SEBI Regulation, the Company is providing the facility to its members to exercise their right to vote by electronic means on any or all the businesses specified in the notice convening the AGM of the Company (remote e-voting), through e-voting service provided by NSDL. The details pursuant to the Act are as under:

A) Members holding shares as on the Cut-off date, i.e. September 21, 2021 (eligible members), to exercise their right to vote by remote e-voting and voting to be held at AGM on any or all of the businesses specified in the Notice convening the AGM.
B) The remote e-voting will commence on September 24, 2021 at 09:00 A.M. and ends on September 27, 2021 at 05:00 P.M. and the remote e-voting module shall be disabled for voting thereafter and voting through electronic means shall not be allowed thereafter. Once the vote on resolution is cast by the member the member shall not be allowed to change it subsequently. Eligible members may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not vote again in the AGM. Only the eligible members shall be entitled to avail the facility of voting at the AGM.
C) In case a person has become the member of the Company after the dispatch of AGM Notice but on or before the cut-off date i.e. September 21, 2021, may write to CS Priyanka Marvania (Company Secretary) at Email ID: cs@sigmacab.com for obtaining the credentials for remote e-voting.
In case you have any queries or issues regarding e-voting, you may write email to evoting@nsdl.co.in or cs@sigmacab.com. Further the documents are available for inspection in electronic mode by an email at cs@sigmacab.com or on the day of AGM & at the registered office of the Company, on all working days between 10:00 A.M. to 06:00 P.M., till the conclusion of meeting.

Date : September 04, 2021
Place : Gondal (Rajkot)

Jigar Cables Limited,
Sd/-, Sangeetaben Vaghasiya
Chairperson and Managing Director

DEMAND NOTICE

Under Section 13(2) of the Securitization And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 (the said Act) read with Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002 (the said Rules). In exercise of powers conferred under Section 13(2) of the said Act read with Rule 3 of the said Rules, the Authorised Officer of IIFL Home Finance Ltd. (IIFL HFL) (Formerly known as India India Infoline Housing Finance Ltd.) has issued Demand Notices under section 13(2) of the said Act, calling upon the Borrower(s), to repay the amount mentioned in the respective Demand Notice(s) issued to them. In connection with above, notice is hereby given, once again, to the Borrower(s) to pay within 60 days from the publication of this notice, the amounts indicated herein below, together with further interest from the date(s) of Demand Notice till the date of payment. The detail of the Borrower(s), amount due as on date of Demand Notice and security offered towards repayment of loan amount are as under:-

Name of the Borrower (s) / Guarantor (s)	Demand Notice Date and Amount	Description of secured asset (Immovable property)
Mr. Shankar Manohar Jagtap, Mrs. Shanta Shankar Jagtap, Mrs. Shashikala Manohar Jagtap (Prospect No. IL10026269)	31-AUG-2021 Rs. 17,16,446/- (Rupees Seventeen Lakh Sixteen Thousand Four Hundred Forty Six Only)	All that piece and parcel of the property being: Flat No 205 2nd Floor, Area Admeasuring 41.9 sq.mt., Wing B Green Glory, Survey No. 6 Hissa No. 2 Area 01 H 02 R. Vadgaon Maval Pune, Maharashtra, India, 412106
Mr. Rahul Ankush Khutwad, Mrs. Komalrathi Khutwad, Shivmihar Automobile Service Centre (Prospect No. IL10036166)	31-AUG-2021 Rs. 18,43,559/- (Rupees Eighteen Lakh Forty Three Thousand Five Hundred Fifty Nine Only)	All that piece and parcel of the property being: 6th Floor, Fd 603 Bldg A-4, Area Admeasuring 452.92 sq.ft. Sahyadri City Nasrapur Bhor Pune, Maharashtra, India, 412131

If the said Borrowers fail to make payment to IIFL HFL as aforesaid, IIFL HFL may proceed against the above secured assets under Section 13(4) of the said Act, and the applicable Rules, entirely at the risks, costs and consequences of the Borrowers. For further details please contact to Authorised Officer at Branch Office: CTS No 42/78/1 to Tanaji Nagar Near Kalika Mata, Mand 2nd Floor Chidwad Pune-411031 Or Corporate Office - IIFL Tower, Plot No. 55, Vidyapeeth, Phase-IV Gurgaon, Haryana. Place: PUNE Date: 04-09-2021. Sd/- Authorised Officer For IIFL Home Finance Ltd. (IIFL HFL)

GOPALA POLYPLAST LIMITED

(CIN:- L25200GJ1984PLC050560)

Registered Office: - Plot No. 485, Santej Vadsar Road, Santej, Tal. Kalol, Dist. Gandhinagar - Gujrat - 382721 Phone : (079) 27561000 Email : info@champalgroup.com

Notice of Annual General Meeting, and remote e-voting information and Book Closure

Notice is hereby given that the 37th Annual General Meeting (AGM) of Gopala Polyplast Limited ("the Company") will be held on Monday, September 27, 2021, at 12:30 P.M. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") in compliance with applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and Securities and Exchange Board of India (SEBI) to transact the Ordinary and Special Businesses, as set out in the notice convening the said 37th AGM. In compliance with the above circulars, the notice of AGM along with the Annual Report for the financial year 2020-21 which includes the process and manner of attending the AGM through VC/OAVM and e-voting has been sent by email on September 02, 2021, to the members whose e-mail address are registered with the Company/ Depository Participant(s). The requirement of sending physical copy of the Notice with Annual Report to the members has been dispensed with as per applicable circulars issued by MCA and SEBI. The said documents are available on the website of Company at www.gopalapolyplast.com, websites of BSE Limited at www.bseindia.com and also on the website of National Securities Depository Limited at www.evoting.nsdl.com.

The documents referred in the Notice of the AGM are available electronically for inspection by the members from date of circulation of the Notice of AGM. Members seeking to inspect such documents can send an email to cs@champalgroup.com

Remote e-voting and e-voting during AGM-

Company is pleased to provide its members, the facility to attend AGM through VC/OAVM and the facility of remote e-voting as well as e-voting during the AGM, to cast their vote electronically on all the resolutions as set out in the Notice of the AGM, and has availed the services of National Securities Depository Limited ("NSDL") for providing facilities. The Register of Members and the Share Transfer Books of the Company will be closed as mentioned in important dates, for the purpose of AGM. The voting rights shall be in proportion to the shares held by members as on cut-off date (as mentioned below). Detailed instruction and information of manner of e-voting by members holding shares and for members who have not registered their email address are provided in the Notice of AGM. The manner in which, persons who become member of the Company after dispatch of Notice and holding shares on cut-off date (as mentioned) member who have forgotten the user id and password, can obtain/ generate the same, as disclosed in Notice.

The Members who have not registered their e-mail addresses with the Company are requested to register them with the Company to receive e-communication from the Company. For registering e-mail address, the Members are requested follow the steps as provided in the Notice.

Important dates-
(1) The Register of Members and the Share Transfer Books of the Company will be closed from Monday, September 13, 2021, to Monday, September 27, 2021. (Both days inclusive) for the purpose of AGM. (2) Cut-off date to determine voting rights and to caste vote- Monday, September 20, 2021 (3) E-voting commences on Thursday, September 23, 2021, at 09:00 A.M. and ends on Sunday, September 26, 2021, at 05:00 P.M. IST.

During this period, members, holding shares, as on the cut-off date, can cast their vote electronically in the manner and process set out in the AGM notice. The remote e-voting module shall be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by the member, the member will not be allowed to change it subsequently. A member can participate in the AGM through VC/OAVM even after exercising the right to vote through remote e-voting but will not be allowed to vote again at the AGM. Members not opting for remote e-voting will be offered the facility of e-voting during the AGM. In case of any queries relating to e-voting as well as attending meeting through VC, members may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in

Joining the AGM through VC/OAVM-
Members will be able to attend the AGM through VC/OAVM through NSDL e-voting system at www.evoting.nsdl.com. The information about login credentials to be used and the step to be followed for attending AGM are explained in Notice.

By order of the Board of Directors
For Gopala Polyplast Limited
CS Khushboo Surana
Company Secretary & Compliance Officer
Membership no- FCS8679
Date : September 03, 2021
Place : Ahmedabad

Asahi Songwon Colors Limited

Regd. Office: "Asahi House", 13, Aaryans Corporate Park, Nr. Shilaj Railway Crossing, Thaltej - Shilaj Road, Thaltej, Ahmedabad - 380 059, Gujarat. Tel: 079-68325000, email: cs@asahisongwon.com, www.asahisongwon.com, CIN:L24222GJ1990PLC014789

NOTICE TO THE MEMBERS OF THE COMPANY REGARDING 31ST ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VC / OAVM

Notice is hereby given that the 31st Annual General Meeting ("AGM") of the members of Asahi Songwon Colors Limited ("the Company") will be convened on Wednesday, 29th September, 2021 at 11:00 AM through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and January 13, 2021 respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 followed by Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular") to transact the business as set forth in the Annual General Meeting Notice, without the physical presence of the Members at a common venue.

The Notice of 31st Annual General Meeting and the Annual Report for the financial Year 2020-21 ("Annual Report") will be sent only by email to all those Members, whose email addresses are registered with the Company or with their respective Depository Participants ("Depository"), in accordance with the MCA Circulars and the SEBI Circular.

Members who have not registered their e-mail addresses with the Depositories/Company/Registrar and Share Transfer Agent ("RTA"), so far, are requested to register/update their e-mail addresses in the following manner:

1) Members holding shares in electronic/demat form, please update your email address with your depository participants. However, Members may temporarily register the same with the Company's Registrar and Share Transfer Agent i.e. M/s. Link Intime India Private Limited at https://web.linkintime.co.in/EmailReg/Email_Register.html on their website in the Investor Services tab by providing details such as Name, DP ID, Client ID, PAN, mobile number and e-mail address.
2) Members holding shares in physical form and who have not registered their email address may register the same with the Company's Registrar and Share Transfer Agent i.e. M/s. Link Intime India Private Limited at https://web.linkintime.co.in/EmailReg/Email_Register.html on their website <https://web.linkintime.co.in/> in Investor Services tab by providing details such as Name, Folio number, Certificate number, PAN, mobile number and email address and also upload the image of share certificate in PDF or JPEG format (upto 1 MB).

On submission of the above member detail, One Time Password (OTP) will be received by the Member which needs to be entered in the link for verification.

The 31st Annual General Meeting Notice will be sent to the shareholders holding shares as on cut-off date for the dispatch, in accordance with the applicable laws, on their registered e-mail addresses in due course. In case of any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 300r send a request to Ms. Sarita Mole at evoting@nsdl.co.in.

Members can join and participate in the 31st Annual General Meeting through VC/OAVM facility only. Necessary arrangements have been made by the Company with National Securities Depository Limited ("NSDL") to facilitate e-Voting. The instruction of joining the 31st Annual General Meeting and the manner of participation in the remote electronic voting or casting vote through e-voting system during the 31st Annual General Meeting is provided in the Notice of the 31st Annual General Meeting. Members participating through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act, 2013. The Notice of 31st Annual General Meeting and the Annual Report will also be available on the website of the Company i.e. www.asahisongwon.com and the website of BSE Limited i.e. www.bseindia.com and on website of NSE limited i.e. www.nseindia.com.

The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, 22nd September, 2021 to Wednesday, 29th September, 2021 (both days inclusive) for the purpose of 31st Annual General Meeting.

Pursuant to the Finance Act, 2020, dividend income is taxable in the hands of the Members and the Company is required to deduct tax at source ("TDS") from dividend paid to the Members at rates prescribed in the Income Tax Act, 1961 (the "IT Act"). In general, to enable compliance with TDS requirements, Members are requested to complete and/or update their Residential Status, PAN, Category as per the IT Act with their DPs or in case shares are held in physical form with the Company/Registrar by submitting the required documents in PDF/JPG format through e-mail or by uploading the documents on the [linkhttps://web.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html](https://web.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html).

The above information is being issued for the information and benefit of all the Members of the Company and is in compliance with the MCA Circulars and SEBI Circular.

For, Asahi Songwon Colors Limited
Place: Ahmedabad
Date: September 3, 2021

Mrs. Paru M. Jaykrishna
Chairperson and Mg. Director

Phoenix Arc Private Limited POSSESSION NOTICE

REGISTERED OFFICE: 5TH FLOOR, DAMI CORPORATE PARK, 150, C-57 ROAD, KALINA, SANTACRUZ (E), MUMBAI - 400098

Whereas, the authorized officer of M/S. Phoenix Arc Pvt Ltd under the securitization and reconstruction of financial assets and enforcement of security interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(2) read with rule 3 of the security interest (enforcement) rules, 2002 issued demand notices to the borrowers, co-borrowers, guarantors as detailed hereunder, calling upon the respective borrowers, co-borrowers, guarantors to repay the amount mentioned in the said notices within 60 days from the date of receipt of the same. The said borrowers, co-borrowers, guarantors having failed to repay the amount, notice is hereby given to the borrowers, co-borrowers, guarantors and public in general that the authorized officer of the company has taken possession of the property described hereunder in exercise of powers conferred on him under section 13(4) of the said act i/rw rule 8 of the said rules on the dates mentioned along with. The borrowers, co-borrowers, guarantors in particular and public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of M/S. Phoenix Arc Pvt Ltd for the amount specified therein with future interest, costs and charges from the respective dates Details of the borrowers, co-borrowers, guarantors, properties mortgaged, name of the trust / outstanding dues, demand notices sent under section 13(2) and amounts claimed there under are given as under:

S. No.	Name and Address of the borrower, Co-Borrower, Loan account No. Loan amount	Details of the securities	1. Name of trust 2. Demand notice date 3. Date of Possession 4. Types of Notice 5. Amount due in Rs.
1	Mr. Jayesh Ghanshyam Panjabi S/o Mr. Ghanshyam Panjabi & Mrs. Vanita Jayesh Panjabi W/o Mr. Jayesh Ghanshyam Panjabi All At: Flat No 702, 7th Floor Garden View Complex, Opp Patel Pragati Nandlal Wadi, Honey Park Road, Surat 395009. Also At: A1, Shiv Apt. Deep Jyoti SOC Palanpur Road, Surat 395009. Mr. Jayesh Ghanshyam Panjabi S/o Mr. Ghanshyam Panjabi/Also At: Sahyog Super Store, 1, Sweet Park, Near LP Sawani School, Honey Park Road, Adajan, Surat. Loan Account Number : 790003 & 7887630 Loan Amount Sanctioned: Rs. 2,94,000/- (Rupees Two Lakh and Ninety Four Thousand Only)	All that piece and parcel of the immovable property bearing Flat No 702 on the 7th floor measuring 1190 sq. ft. in the building known as "Garden View Complex" constructed on the plot of land bearing Revenue Survey No 162-3 TP Scheme No 13 Final Plot No 32-C measuring 2868 sq.mts. Paikse Sub-Plot Nos 1, 2 & 3 situated in State Gujarat District Surat Sub District and Taluka Choryasi Moje Adajan. Name of the Mortgagor: Mr. Jayesh Ghanshyam Panjabi S/o Mr. Ghanshyam Panjabi	1) Phoenix Trust FY13-2 Scheme C 2) 11.06.2014 3) 02.09.2021 4) Physical Possession. 5) Rs. 43, 80,519/- (Rupees Forty Three Lakh Eighty Thousand One Hundred and Twenty Three Only) due and payable as of 11.06.2014 with further interest applicable from 12.06.2014 along with costs and charges until payment in full.
2	Mr. Ajay Subhash Bhagat S/o Mr. Subhash Bhagat & Mr. Jyoti Bhagat W/o Mr. Ajay Subhash Bhagat Both At: Building No. C-3, Flat No. C-503, Yagnik Residency, 5th Floor, Nr. SEBI, LP. Savani School, Nr. Jalaram Temple, Adajan, Surat - 395009 Also Both At: Building No 2 Flat No. 69, Teachers Colony, Western Express Highway, Khar, (E), Mumbai 400051 Also Both At: Shop No. 5, Nirman Bhavan, Majure Gate, Surat - 395001. Loan Account Number: 5223013 Loan Amount Sanctioned: Rs. 24, 50, 000/- (Rupees Twenty Four Laks and Fifty Thousand Only)	All That Piece And Parcel Of The Property Bearing Flat No-C-503 On The 5th Floor Admeasuring 62.70 Sq. Meters I.E. 675 Sq. Fts. Along With Undivided Shares In The Land Of "Yagnik Residency Building No. C-3" Situated At Revenue Survey No. 81/1, T.P. Scheme No. 32(Adajan), Final Plot No-51 Of Moje Adajan, City Of Surat. Boundaries are: North: Flat No.504, South: Open Space & Sai Rachana Society, West: Open Space & Sai Rachana Society. Name of the Mortgagor: Mr. Ajay Subhash Bhagat S/O Mr. Subhash Bhagat	1) Phoenix Trust FY19-5 Scheme E 2) 16.06.2021 3) 02.09.2021 4) Symbolic Possession. 5) Rs. 43, 80,519/- (Rupees Forty Three Lakh Eighty Thousand Five Hundred And Ninety Nine Only) dues and payable as of 15.06.2021 with further applicable interest from 16.06.2021 along with costs and charges until payment in full.

Place: Surat
Date: 02.09.2021
Sd/- Authorised Officer
For Phoenix Arc Private Limited
For Any Query Please Contact Mr. Kishore Arora (+91 72279 53457) & Mr. Ravinder Singh Godara (+91 983999074)

MAHINDRA RURAL HOUSING FINANCE LIMITED Demand Notice

Corporate Office:- Mahindra Rural Housing Finance Ltd. Sadhana House, 2nd Floor, 570, P.B. Marg Worli, Mumbai 400 018 India, Tel: +91 22 66523500 Fax: +91 22 24972741
Regional Office: 82-A, New Tower Building, Thaltej Cross Road, Thaltej, Ahmedabad-380054

Under Section 13(2) of the Securitization And Reconstruction of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 (the said Act) read with Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002. The undersigned is the Authorized Officer of Mahindra Rural Housing Finance Ltd. (MRHL) under the said Act. In exercise of powers conferred under Section 13(2) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer has issued Demand Notices under section 13(2) of the said Act, calling upon the following Borrower(s) ("the said Borrower(s)"), to repay the amounts mentioned in the respective Demand Notice(s) issued to them that are also given below. In connection with above, Demand Notice is hereby given, through this publication, to the said Borrower(s) (Names and addresses mentioned below) calling upon them to pay and discharge in full their liabilities to MRHL, within 60 (sixty) days from the date of this notice. Following are the details of the amount payable in loan account:

As security for due repayment of the loan, the following assets have been mortgaged to MRHL by the said Borrower(s) respectively.

S.N.	Name of the Borrower(s) / Guarantor (s)	Address of Borrower(s)/ Guarantor	Demand Notice Date and Amount	Description of Secured asset (Immovable Property)
1.	Loan Account No.288882, BRANCH- SURAT, 1.MUKESH AMRUTL UNADKAT, 2.KIRAN KUNESH UNADKAT	PLOT NO.17,JAY JAGDISH NAGAR SOCIETY, FOUR FLOOR,KARJAN, L.H. ROAD, SAYAN (CT), ANAND, GUJARAT -394210	14-02-2020 Rs.5,31,307/-	FLAT NO.306,JIVANDHARA RESIDENCY-1,ANKURNAGAR TENAMENT-2,OLPAD,SAYAN, SURAT,GUJARAT - 394210
2.	Loan Account No.978557, BRANCH- BHARUCH, 1.MANOJKUMAR RAMDEV MAHANTO, 2.SURJAYADEEP SOCIETY BHADKODARA (CT) A/6 SURYADEEP SOCIETY, BHADKODARA (CT), ANKLESHWAR, BHARUCH, GUJARAT -393001	9/5 SAFFED COLONY, KOSAMADI, ANKLESHWAR, BHARUCH, GUJARAT - 393001	13-08-2021 Rs.11,43,304/-	SUR NO.113,PLOT NO.41, GREEN CITY, MOUJ E JITALI, ANKLESHWAR, BHARUCH, GUJARAT -393002
3.	Loan Account No.1216946, BRANCH- SURAT, 1.RAFIK RAGHU ANSARI, 2.NABISAPARVEEN RAFIK ANSARI, 3.WAKIL MOJIM SHEKH	44/2,97,KHANPURA 2 ND FLOOR,MITHI KHADI NR SANJAY CIRCLE, SURAT, SURAT CITY, SURAT, GUJARAT -394210 PLOT NO.89,1ST FLOOR, SURVEY NO.19 MHAPRABHU NAGAR, NR SANJAY CIRCLE SURAT GUJARAT-394210	20-02-2020 Rs.10,56,096/-	PLOT NO.122, SN RESIDENCY,, HALDARU ROAD, SURAT, SURAT CITY,SURAT-KAMREJ, GUJARAT -394150
4.	Loan Account No.1280345, BRANCH- SURAT, 1.ANSHU ANAND SINGH, 2.ANSHU AJIT SINGH, 3.SANGRAM TAKHAT SINH	PLOT NO B- 484, MANSAROVAR SOCIETY, OPP RAMDEV MEDICAL, NEAR KRISHNA SCHOOL, GODADARA, SURAT, GUJARAT -395010 1.MAHADEVBHAI SHANKARBHAI PRAJAPATI, 2.KOKILABEN GIRISHBHAI PRAJAPATI, 3.KIRTIKUMAR JAYANTIBHAI PRAJAPATI	13-08-2021 Rs.9,12,466/-	PLOT NO - 111, SURYA KRAN RESIDENCY,, KHARACH GAM, HANSOT,KOSAMBA, BHARUCH- SURAT, GUJARAT -394120
5.	Loan Account No.554787, BRANCH- AHMEDABAD, 1.SAVITABEN JASHBHAI PRAJAPATI, 2.JASHBHAI DAHYABHAI PRAJAPATI	PRAJAPATIVAS NEAR BUS STAND AT UNDR, UNDR, ANAND, AHMEDABAD- KHEDA, GUJARAT -388250	13-08-2021 Rs.6,36,418/-	GRAM PANCHAYAT MILKAT NO. 1/70 MOUJE UNDR,TALUKA MAHUDA, DISTRICT KHEDA, UNDR,MAHUDA,NADIAD- MAHUDA LOCAT ,GUJARAT -388250
6.				

SIGMA
WIRE & CABLES (ભારત) CIN:L28999GJ2017PLC09565
વેબસાઇટ : www.sigmacab.com, ફોન : +91-2825-221422, ઈ-મેઇલ : info@sigmacab.com

૫ મી વાર્ષિક સાધારણ સભા, હાલ કોલકાત અને ઈ-વોટિંગ માટેની સૂચના
અહીં સૂચના આપવામાં આવી છે જે યજમાન ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ૫ મી વાર્ષિક સાધારણ સભા (એજન્ટ) અંગણવાર, સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૧ના રોજ બપોરે ૦૪:૩૦ કલાકે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પ્લોટ નંબર ૧૬૪/૧૪ અને ૧૫, ખામવાડી, જી.આઈ.સી.સી., ગોલ્ડ, રાજકોટ - ૩૬૦૩૧૧, ગુજરાત (ભારત) ખાતે રાખવામાં આવી છે. જેમાં ઓગસ્ટ ૨૦, ૨૦૨૧ની બોર્ડ મીટિંગમાં મંજૂર કરાયેલ નોટિસમાં નક્કી કર્યાં મુજબ ધોળાનો વ્યવહાર કરવામાં આવ્યો છે.

એજન્ટને સૂચના કંપનીના બધા સભ્યોને ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે જેમાં ઈમેલ આઈડી કોપી/ફોટો સહભાગીઓ (ડીપી) સાથે નોંધાયેલા છે. જે સભ્યોના ઈમેલ નોંધાયેલા નથી, તેમને નોટિસની કલ્પિત નોંધવામાં સરખાવે મોકલવામાં છે. શેરહોલ્ડરો કે જેમણે અચ્છા રીટાઇન ઈમેલ આઈડી નોંધાવેલા નથી, તેમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઈમેલ આઈડીને નોટિસ સાથે નોંધાવેલ ફોર્મ ભરીને નોંધાવી શકે.

કંપનીના નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો એજ્યુઅલ રિપોર્ટ તથા નોટિસ કંપનીની વેબસાઇટ www.sigmacab.com, બોને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરિસ લિમિટેડ (એનસીડીએલ)ની વેબસાઇટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ રહેશે. જે સભ્યોના ઈમેલ આઈડી/ડીપી સાથે નોંધાયેલા છે તેઓને તેના ક્રમ અનુસાર નોંધવામાં આવેલ ઈમેલ પર મોકલી આપવામાં આવશે છે. જે સભ્યોના ઈમેલ આઈડી નોંધાયેલા નથી અથવા જેમને એજ્યુઅલ રિપોર્ટ અને નોટિસ ના મળેલ હોય તેવા સભ્યો CS@sigmacab.com પર ઈમેલ દ્વારા પોતાના ડીપી/કલારબટ આઈડી, નામ, PAN, મોબાઇલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધાવી શકશે. જે સભ્યોએ ઈમેલ આઈડી નોંધાવેલ નથી, તેઓ પણ એજન્ટની નોટિસમાં દર્શાવેલ કોષ્ટક માટે પોતાનો મત એજન્ટની નોટિસમાં દર્શાવવા મુજબ સિમોટ ઈ-મટદાનથી અથવા એજન્ટને દર્શાવેલા પોતાનો મત આપી શકશે. સભામાં જારૂ રહેવા માટેની મતદાનની પ્રક્રિયાની સૂચનાઓ ૫ મી સાધારણ સભાની નોટિસમાં આપવામાં આવી છે જે ઉપ દર્શાવેલ વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવી છે.

કંપનીના અધિનિયમ, ૨૦૧૩ (એક્ટ)ની કલમ ૬૯ અને અનુચ્છ, કંપનીએસ (એનજેએટ) અને એસિમિટરિસ (સીઆઈએસ) નિયમ, ૨૦૧૪ અને સેબીના નિયમન ૪૨ (સિસ્ટીંગ ઓપિનિયન અને ડીસક્લોઝર આયશકતાઓ) રેગ્યુલેશન, ૨૦૧૫ (સેબી રેગ્યુલેશન), આગામી એજન્ટને હેતુ માટે કંપનીના સભ્યોને સ્ટુટન્ટ અને શેર ટ્રાન્સફર બુક આગામી સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૧ (મને ટિપ્સ સક્રિય) બંધ રહેશે. સેબી રેગ્યુલેશન ૪૨ મુજબ તેના નિયમન મુજબ કંપનીએ (એનજેએટ અને એસિમિટરિસ) નિયમ, ૨૦૧૪ના નિયમ ૨૦ ની સાથે વાંચવામાં આવેલા અધિનિયમની કલમ ૧૦૮ની શરતમાં કંપની તેના સભ્યોને તેમના અધિકારો ઉપયોગ કરવા સુધિ આપી રહી છે. એનસીડીએલ દ્વારા પ્રદાન કરવામાં આવેલા ઈ-મટદાન સેવા દ્વારા, કંપનીના એજન્ટને (દૂરસ્થ ઈ-મટદાન) નોંધાવવામાં સૂચનામાં ઉલ્લેખિત કોષ્ટક અથવા તમામ વ્યવસ્થાઓ પર ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મત આપી શકાશે. અધિનિયમ મુજબની વિગતો નીચે મુજબ છે :

(એ) છેલ્લી તારીખ, એટલે કે સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૧ ના રોજ શેર ધરાવતા સભ્યો (પાત્ર સભ્યો), એજન્ટને નોંધાવવાની નોટિસમાં ઉલ્લેખિત કોષ્ટક પણ અથવા તમામ ઘંટા પર એજન્ટને પર જોજનારી દૂરસ્થ ઈ-મટદાન દ્વારા તેમજ એજન્ટને દર્શાવેલા મતદાન કરવાના તેમના અધિકારો ઉપયોગ કરી શકશે.

(બી) દૂરસ્થ ઈ-મટદાન સપ્ટેમ્બર ૨૪, ૨૦૨૧ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૧ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે અને દૂરસ્થ ઈ-મટદાન મુજબ વ્યવસ્થા અત્તર માટે અસક્ષમ કરવામાં આવશે. તથા વ્યવસ્થાદ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એકવાર સભ્ય દ્વારા જારૂ પર મત આપ્યા પછી, સભ્યને તે પછીથી વધવાવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દૂરસ્થ ઈ-વોટિંગ દ્વારા તેના મતના અધિકારો ઉપયોગ કર્યા પછી પણ પાત્ર સભ્યો એજન્ટમાં ભાગ લઈ શકે છે પરંતુ એજન્ટમાં ફરીથી મત આપી શકશે નહીં. એજન્ટને દર્શાવેલા કલ્પિત પાત્ર સભ્યો જ મતદાનની સુધિમાં મેળવવા માટે હકદાર રહેશે.

(સી) જો કોઈ વ્યક્તિ એજન્ટને નોટિસ મોકલ્યા પછી કંપનીનો સભ્ય બન્યો હોય પરંતુ છેલ્લી તારીખ એટલે કે સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૧ પહેલાં, તેઓ પ્રિચાલ મારવાણીયા (કંપની સંધિ) ના ઈમેલ આઈ ડી CS@sigmacab.com ઉપર દૂરસ્થ ઈ-મટદાન માટેના ઓળખપત્રો મેળવવા માટે ઈમેલ કરી શકે છે.

ઈ-મટદાન ને લગતા તમારા કોષ્ટક પણ પ્રત્યેક અથવા સમસ્તઓ માટે તમે evoting@nsdl.co.in અથવા CS@sigmacab.com પર ઈમેલ લખી શકો છો. વધુમાં જણાવતા, કંપનીના દસ્તાવેજોના વિનિદાશ માટે તમે CS@sigmacab.com ઉપર ઈમેલ કરી શકો છો અથવા એજન્ટનેના ટિપ્સ અને કંપનીની સ્ટુટન્ટ ઓફિસ બધા કામચલાઉ ટિપ્સ સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૦૬:૦૦ વાગ્યા સુધીમાં, મીટિંગના સમાપ્તિના ટિપ્સ સુધી ઉપલબ્ધ રહેશે.

પ્રશાંત ઈન્ડિયા લિમિટેડ
રજી. ઓફિસ વ્હોલ નં. ૪૫૬, એન. એચ. નંબર ૨, પલસાણા ચાર રસ્તા, પલસાણા, તાલુકો પલસાણા, જિલ્લો-સુરત-૩૬૪૩૧૫
CIN : L15142GJ1983PLC006574 ફોન. ૯૩૦૦૫૫૫૫
ઈ-મેઇલ : cs.prashantindia@gmail.com, વેબસાઇટ : www.prashantindia.info

નોટિસ
અહીં સૂચના આપવામાં આવી છે કે પ્રશાંત ઈન્ડિયા લિમિટેડના સભ્યોની ૩૮મી વાર્ષિક સામાન્ય સભા પુલવલે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાશે. વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં જણાવેલ સામાન્ય અને ખાસ વ્યવસ્થાને વ્યવહાર કરવા માટે વિડિયો કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓફિસો વિઝ્યુઅલ મીડિયમ (ઓએવીએમ) દ્વારા (અહીં "ઈલેક્ટ્રોનિક મીડિયમ" તરીકે ઓળખાવે છે) રાખવામાં આવી છે.

સતત કોલિડ-૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને, કોર્પોરેટ અહેસં મંત્રાલય ("એમસીએ") તેના સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, ૧૬/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦, ૨૨/૨૦૨૦, ૩૩/૨૦૨૦, ૩૬/૨૦૨૦, ૦૨/૨૦૨૧, ૧૦/૨૦૨૧ (વ્યવસ્થાદ સામૂહિક રીતે "એમસીએ પરિપત્રો") તરીકે આગળવાર છે. એ સામાન્ય રીતે સભ્યોની શારીરિક હાલતી વિના વીડીયો અથવા ઓએવીએમ દ્વારા વાર્ષિક સામાન્ય સભા યોજવાની મંજૂરી આપી છે. આ એમસીએ પરિપત્રો અને કંપની એક્ટ ૨૦૧૩ અને સેબી (સેબીના ઓપિનિયન અને ડીસક્લોઝર આયશકતાઓ નિયમ), ૨૦૧૫ની સંબંધિત નોંધવાઈએના પાલનમાં, કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય ઠેકડા વિસી/ ઓએવીએમ દ્વારા રાખવામાં આવશે. ક્ષતિના સિવાય વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક અહેવાલ સાથે વાર્ષિક સામાન્ય સભાની નોટિસ ફક્ત તે વચ્ચે ઈલેક્ટ્રોનિક મીડિયમ દ્વારા મોકલવામાં આવશે, જેમાં ઈ-મેઇલ સરખાવેલ કંપની/ડિપોઝિટરિસના ઉપરોક્ત અમરિટિયમ પરિપત્રો અને સેબી દ્વારા SEBI/HO/CFD/CMD/IR/P/2020/79 ના નો. SEBI/HO/CFD/CMD/IR/P/2020/199 અનુસાર સ્ટુટન્ટ રહેશે છે. ક્ષતિના સિવાય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વાર્ષિક અહેવાલ અને નોટિસ કંપનીની વેબસાઇટ www.prashantindia.info અને સ્ટોક એક્ષચેન્જની વેબસાઇટ એટલે કે નીએસઈ લિમિટેડ www.bseindia.com પર ઉપલબ્ધ છે. એમસીએ અને સેબી દ્વારા જારૂ કરાયેલા ઉપરોક્ત પરિપત્રોને અનુલભીને અને વાર્ષિક રિપોર્ટ ૨૦૨૦-૨૧ ની ભૌતિક નકલો મોકલવામાં સામેલ મુદતોનો અભાવ છે, અને વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લઈ શકે છે. વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચના વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. વીસી/ઓએવીએમ દ્વારા ઠેકડામાં ભાગ લેવાના સભ્યોની ગણતરી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૩ હેઠળ કરાવેલી ગણતરીના હેતુ માટે કરવામાં આવશે.

હુલ ધંધની નોટિસ
આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીના અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૬૯ ની જોવાઈએ અનુસાર અને સેબી (સિસ્ટીંગ ઓપિનિયન અને ડીસક્લોઝર ૪૨૪૨૪૨) રેગ્યુલેશન, ૨૦૧૫ની કલમ ૨૩ની જોવાઈએ અનુસાર, કંપનીના અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૬૯ની જોવાઈએ અનુસાર, કંપનીના સભ્યોની નીચેની રીતે શેર ટ્રાન્સફર બુક, ૩૮મી વાર્ષિક સામાન્ય સભાના ઠોળાના કારણે તા. ૨૩-૦૯-૨૦૨૧ થી ૨૯-૯-૨૦૨૧ સુધી (બન્ને તારીખો સામેલ) બંધ રહેશે.

ઈ-વોટિંગની નોટિસ
આથી નોટિસ આપવામાં આવે છે કે કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૦૮ અને તેને સંબંધિત નિયમ હેઠળ સમસ્ત-સમય પર સુધારા કરીને અને સેબીના નિયમ નંબર ૪૨ (સિસ્ટીંગ ઓપિનિયન અને ડીસક્લોઝર ૪૨૪૨૪૨) રેગ્યુલેશન, ૨૦૧૫ અને સામાન્ય સભા પર સેક્રેટરીઅલ ઈમેલ દ્વારા અનુસાર, કંપની દ્વારા રીમોટ ઈ-વોટિંગની સુધિ પુરી પાડવામાં આવી છે. આ સુધિમાં કંપની વાર્ષિક સામાન્ય સૂચનામાં સ્પષ્ટ કરેલા તમામ કરવા પર ઈલેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શકશે. આ ઉપરાંત વાર્ષિક સામાન્ય સભા દરમિયાન કંપની ઈ-વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવાની સુધિ પ્રદાન કરી રહી છે. (" ઈ-વોટિંગ") સિમોટ ઈ-વોટિંગ / ઈ-મટદાન માટેની વિગતવાર પ્રક્રિયા (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરિસ લિમિટેડ (એનસીડીએલ) દ્વારા પ્રદાન કરાયેલા) વાર્ષિક સામાન્ય સભાની સૂચના આપવામાં આવી છે. સભ્યોને વાર્ષિક સામાન્ય સભાની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. જે કંપનીની વેબસાઇટ પર પણ પ્રદર્શિત થાય છે. બોર્ડ ઓફ ડિરેક્ટરસની મિટિંગમાં પુરા પાડવામાં આવતા સિમોટ-ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ ની તપાસના હેતુ માટે જુદા જુદા રમણાવા ભખતને સહકારાઈએ તરીકે નિયુક્ત કર્યા છે. ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન તા. ૨૩.૦૯.૨૦૨૧ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે અને તા. ૨૯.૦૯.૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે. સહકારાઈએ રિપોર્ટ સાથેની ઈ-વોટિંગના પરિણામો કંપનીની વેબસાઇટ પર અને નીએસઈ અને એનસીડીએલની વેબસાઇટ પર દર્શાવવામાં આવશે.

ઈ-મેલ આઈડી અને ઠેકડા ખાતાની વિગતોની નોંધવાની પ્રક્રિયા :
૧. ભૌતિક સિદ્ધાંત રાખવામાં આવેલા શેરોના કિસ્સામાં :
શુભા કરીને સિદ્ધિઓ નંબર, શેર ધારકનું નામ, પાન(પાનકાર્ડની સ્વયં પ્રમાણિત સ્કેન કરેલી નકલ), સંપર્ક નંબર, ઈ-મેલ સરનામું અને ઠેકડા ખાતાની વિગતો સાથે તમારી ઠેકડા રકમ કરાવેલ શેરની નકલની નકલ, એમસીએસ શેર ટ્રાન્સફર એન્ટ-લિમિટેડ ઉપર મોકલવી: mcs@shahmd@gmail.com

૨. ડિમેટ મોડમાં રાખવામાં આવેલા શેરોના કિસ્સામાં :
શેરહોલ્ડર રૂબા કરીને ડિપોઝિટરી પાર્ટીસિપન્ટ ("ડીપી") નો સંપર્ક કરી શકે છે અને ડી.પી. દ્વારા સુચવેલી અને સલાહ મુજબની પ્રક્રિયા મુજબ ડીમેટ ખાતામાં ઈ-મેલ સરનામું અને ઠેકડાખાતાની વિગતોની નોંધાવી કરાવી શકે છે :
જો શેર હોલ્ડરોને વિષય અને નિયમો અંગે કોઈ પ્રશ્નો હોય તો તેઓ કંપનીને ફોન : - ૦૯૩૦૫૫૫૫૫૫૫ પર અને ઈમેલ: cs.prashantindia@gmail.com પર સંપર્ક કરી શકે છે.

ભાગ એન્ટર ઓફ વોર્ડ
પ્રશાંત ઈન્ડિયા લિમિટેડ
સ્થાન : સુરત
તારીખ ૦૪/૦૯/૨૦૨૧

Ashapura
આશાપુરી ગોલ્ડ ઓનિમેન્ટ લિમિટેડ
(CIN:L36910GJ2008PLC054222)
રજીસ્ટર્ડ ઓફિસ : ૧૦૯ થી ૧૧૨ અને ૧૧૩, લાલ બંગલા, લાલ બંગલા પ્લોટ, લાલ બંગલા પ્લોટ, સી.જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ગુજરાત, ભારત. ફોન : +91-79-2646-2170-71
ઈ-મેઇલ: ashapurigold@gmail.com વેબસાઇટ: www.ashapurigold.com

૧૩મી વાર્ષિક સામાન્ય સભાને લાગતી નોટિસ

સૂચના અહીંથી આપવામાં આવે છે કે કંપનીની તેમની વાર્ષિક સામાન્ય સભા (એજન્ટ) સોમવાર, ૨૪મી, સપ્ટેમ્બર, ૨૦૨૧ને ૦૯:૦૦ વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ (વીસી) / અન્ય ઓફિસો વિઝ્યુઅલ માધ્યમ ("ઓએવીએમ") દ્વારા એજન્ટની નોટિસમાં આપેલા હેરાવને મંજૂર કરવા રાખેલ છે. એજન્ટની નોટિસ બધા સભ્યોને મોકલી દેવામાં આવી રહી છે.

સતત કોલિડ-૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને, કોર્પોરેટ અહેસં મંત્રાલય (એમસીએ) તરીખ પમે, ૨૦૨૦ તેના પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ સાથે વાંચવામાં આવેલ પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, ૧૬/૨૦૨૦ અને ૨૨/૨૦૨૦ તારીખ ડી મી એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૧૩ જાન્યુઆરી, અનુક્રમે (સામૂહિકરૂપે "એમસીએ પરિપત્રો"), કંપની એક્ટ, ૨૦૧૩ના નિયમો અને સેબી (સિસ્ટીંગ ઓપિનિયન અને ડીસક્લોઝર રેગ્યુલેશન) રેગ્યુલેશન, ૨૦૧૫ ની સંબંધિત જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આ એમસીએ વીસી/ઓએવીએમ દ્વારા ધોળામાં આવે છે. વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ સાથે એજન્ટની સૂચના ફક્ત તેજ સભ્યોને ઈલેક્ટ્રોનિક મીડિયમ દ્વારા મોકલવામાં આવશે જેને પોતાની ઇ-મેઇલ કંપની/ ડિપોઝિટરીમાં નોંધાયેલી હશે, આ એમસીએના પરિપત્રો તથા સેબીના પરિપત્ર નં. સેબી/એચઓ/સીએમડી/સીઆઈઆઈઆર/૨૦૨૦/૭૯તા. ૧૨ મે ૨૦૨૦ અને પરિપત્ર નં. સેબી/એચઓ/સીએમડી/સીઆઈઆઈઆર/૨૦૧૯/૧૧ તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ (સામૂહિકરૂપે "સેબીના પરિપત્રો")ની જોગવાઈમાં છે. સભ્યો ની લેઈ ઈ-વોટિસ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ કંપનીની વેબસાઇટ www.ashapura.com, સ્ટોક એક્સચેન્જ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડની વેબસાઇટ www.bseindia.com અને સીડીએસએલની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ હશે. સભ્યો ફક્ત વીસી/ ઓએવીએમ સુધિમાં દ્વારા જ એજન્ટમાં જારૂ આપી અને ભાગ લઈ શકે છે. એજન્ટમાં જોડાવા માટેની પ્રક્રિયા એજન્ટની સૂચનામાં આપવામાં આવી છે. વીસી/ ઓએવીએમથી ઠેકડામાં જારૂ આપનારા સભ્યોને જ કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૩ મુજબ કોમ હુલ ગણવામાં આવશે.

કંપની એજન્ટની સૂચનામાં આપેલા તમામ કરવા પર પોતાના મત આપવા માટે તેના તમામ સભ્યોને સિમોટ ઇ-મટદાન સુધિમાં ("સિમોટ ઇ-વોટિંગ") પ્રદાન કરી રહી છે. સભ્યો એ એજન્ટને દર્શાવેલા ઇ-વોટિંગ સુધિમાં અથવા સિમોટ ઇ-વોટિંગનો ઉપયોગ કરીને કોષ્ટકમાં કરવા પર પોતાનો મત આપવાનો અભિપ્રાય છે. સિમોટ ઇ-વોટિંગ અને એજન્ટને દર્શાવેલા ઇ-વોટિંગ સુધિમાં પ્રક્રિયાની વિગતવાર કાર્યવાહી કંપની એજન્ટની સૂચનામાં આપેલી છે. આગળના સમયમાં બધા પાત્રવા વ્યક્તિને મેળવવા અને બેંક એકાઉન્ટ અપડેટ કરવા તમારા ડિપોઝિટરી પાર્ટીસિપન્ટ (ડીપી) ને સંપર્ક કરવું.

ડિરેક્ટર મંડળના હુકમ દ્વારા આશાપુરી ગોલ્ડ ઓનિમેન્ટ લીમિટેડ
સંબંધિત
સરમલ સંબંધિત સોની ચેરમેન એન્ટરપ્રાઇઝિસ ડિરેક્ટર
ડીન: ૦૨૨૮૬૭૫૦

સ્થાન : અમદાવાદ
તારીખ : સપ્ટેમ્બર, ૦૪, ૨૦૨૧

VOLTAMP TRANSFORMERS LIMITED
CIN: L31100GJ1967PLC001437
Regd. Office : Makarpura, Vadodara-390014, Gujarat (India)
Phone : +91 265 2642011 / 2642012 / 3041480. Fax : +91 265 2646774 / 3041499
E-mail : voltamp@voltamptransformers.com, Website : www.voltamptransformers.com

NOTICE
Notice is hereby given that the 54th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Thursday, 30th September, 2021 at 10:00 a.m. (IST) through video conference ("VC") or other audio visual means ("OAVM") facility, in compliance with the provision of the Companies Act, 2013 ("the Act") and the rules thereof, as amended, with the General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No.17/2020 dated 13th April, 2020 and General Circular No. 20/2020 dated 5th May, 2020, Circular No. 02/2021 dated January 13, 2021 issued by the Ministry of Corporate Affairs (collectively referred as "MCA Circulars") read with SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 and in compliance with the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 to transact the businesses set out in the Notice convening 54th AGM.

In compliance with the MCA Circulars and SEBI Circulars, Notice convening AGM setting out the businesses to be transacted at the Meeting and the Explanatory Statement attached thereto along with the 54th Annual Report for the FY 2020-21, sent through electronic mode to those shareholders whose email id registered with the depositories/Company. Further The Company has also uploaded the Notice and Annual Report on its website www.voltamptransformers.com and the websites of the stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nsdl.com respectively and the website of National Securities Depositories Limited ("NSDL") an agency appointed for providing facility for remote e-voting, participation in the AGM through VC / OAVM and e-voting during the AGM at www.evoting.nsdl.com. Notice is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and the applicable rules made thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, 24th September, 2021 to Thursday, 30th September, 2021 (Both days inclusive), for determining the eligibility of the members to cast their vote by remote e-voting or by e-voting at the Annual General Meeting. Further, pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015:

1. Dispatch of Notice of AGM along with Annual Report completed through electronic mode as on 2nd September, 2021.
2. The remote e-voting period commences on Monday, 27th September, 2021 at 9:00 am (IST) and ends on Wednesday, 29th September, 2021 at 5:00 pm (IST). The remote e-voting module shall be disabled by NSDL for voting beyond 5:00 pm (IST) on Wednesday, 29th September, 2021.
3. A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories, as on the cut-off date, Thursday, 23rd September, 2021, shall be entitled to avail facility of remote e-voting as well as voting in the general meeting.
4. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. 23rd September, 2021, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or vadodara@linkintime.co.in.
5. Members may go through the instructions for e-voting mentioned in Note No. 8 of the AGM Notice and in case of any queries, may refer to Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the Downloads section of www.evoting.nsdl.com
6. The members are also informed that:
 - a. The members attending AGM through VC / OAVM facility and who have not casted their votes by means of remote e-voting, shall be entitled to cast the vote through e-voting at the AGM.
 - b. The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again in the meeting.
7. The Notice of AGM of the Company inter alia indicating the process and manner of e-voting process and attending AGM through VC / OAVM facility, is available on the NSDL's website https://www.evoting.nsdl.com and the Company's website www.voltamptransformers.com, and on the web sites of the stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nsdl.com respectively.
8. In case of any queries, the members may refer the Frequently Asked Questions (FAQs) for members and e-voting under manual for members available at the downloads section of www.evoting.nsdl.com or call on toll free number 1800-1020-990 and 1800 22 44 30 or send a request to evoting@nsdl.co.in to whom will address the grievances relating to electronic voting.

By order of the Board
For VOLTAMP TRANSFORMERS LIMITED
SANKET RATHOD
Date Vadodara
Date 03.09.2021
COMPANY SECRETARY

CRCW
CENTRAL RAILSIDE WAREHOUSE COMPANY LIMITED
(A Govt. of India Enterprise-Mini Ratna Company)
Ref. No. Crwc-1/Recruitment/ 2021/915 Closing Date: 30.09.2021
Central Railside Warehouse Company Ltd (a Govt. of India Enterprise) invites applications for various posts through Immediate Absorption basis as per the details given below:
Name of the post Pay Scale / Grade No. of Post
Executive (Commercial) Rs 30000-120000 / EO Grade 05
Executive (Civil) Rs 30000-120000 / EO Grade 05
Executive (Electrical) Rs 30000-120000 / EO Grade 02
Max Age limit is 55 years as on 01.09.2021.
Visit CRWC website https://crwc.in/en/careers-0 for detailed advertisement alongwith the instructions to apply for the aforesaid posts, etc. Sr. Manager (HR)

PFC CONSULTING LTD.
(A wholly owned subsidiary of PFC Ltd. A Govt. of India Undertaking)
NOTICE INVITING EXPRESSION OF INTEREST
PFC Consulting Limited (PFCL), a wholly owned subsidiary of Power Finance Corporation Limited (A Government of India Undertaking), is appointed by Ministry of Power for conducting 4th round of auction under B (II) of SHAKTI Policy issued by Ministry of Coal on 22.05.2017 and amendment on 25.03.2019. Bidders may download the Expression of Interest from PFCL website www.pfcclindia.com or from MSTC ecommerce website https://www.mstcecommerce.com/auction/home/shakti/index4.jsp Bidders should regularly visit website to keep themselves updated regarding clarifications/amendments/lime extensions, etc., if any. Note: PFC Consulting Limited reserves the right to cancel or modify the process without assigning any reason and without any liability. This is not an offer. Corporate Office: 9th Floor (A Wing) Statesman House, Connaught Place, New Delhi - 110001

અનુસૂચિ I - કોર્મ એ - સાર્વજનિક જાહેરાત
(ઈ-સોલ્વન્સી એન્ડ ઍક્સપ્રીઝી ઓફ ઈન્ડિયાના નિયમન ૧૪ (સ્ટ્રેચિક લિક્વિડેશન પ્રક્રિયા) નિયમો, ૨૦૧૭)
ઈ-કોમ ઓપોસ્યુનિટીઝ પ્રાઈવેટ લિમિટેડના સ્ટેકહોલ્ડર્સના ઘ્યાન માટે

1 કોર્પોરેટ વ્યક્તિનું નામ	ઈ-કોમ ઓપોસ્યુનિટીઝ પ્રાઈવેટ લિમિટેડ
2 કોર્પોરેટ વ્યક્તિના સમાવેશ ની તારીખ	01/02/1999
3 ઓથોરિટી કે જેના હેઠળ કોર્પોરેટ વ્યક્તિ ઈ-કોર્પોરેટ / નોંધાયેલ	આરઓસી- અમદાવાદ, ગુજરાત કંપની એક્ટ ૧૯૫૬ની જોગવાઈ હેઠળ સમાવેલ
4 કોર્પોરેટ ઓળખ નંબર / કોર્પોરેટ વ્યક્તિની મર્યાદિત જવાબદારી ઓળખ નંબર	U72200GJ1999PTC035359
5 કોર્પોરેટ વ્યક્તિની રજિસ્ટર્ડ ઓફિસ અને મુખ્ય ઓફિસનું સરનામું (જો કોઈ હોય તો)	૭૯, ૭મા માળે, વ્હાઈટ હાઉસ ઓફિસબીજ, અમદાવાદ-૩૯૦૦૦૬, ગુજરાત
6 કોર્પોરેટ વ્યક્તિની લિક્વિડેશન શરૂ થવાની તારીખ	31/08/2021
7 નામ, સરનામું, ઈમેઈલ સરનામું ટેલીફોન નંબર અને લિક્વિડેશનનો નોંધણી નંબર	આશીષ શાહ ૨૦